

ન.ટી.પી./મસલ/બખ્ર/એસઆરનંંં ૭/દ. ૦૮૫ /૧૧  
તાલુકા પંચાયત કચેરી, ધોળકા  
તારીખ: ૩૦/૪/૨૦૧૧

વચાણી લીધુ :-

- (૧) મોજે નાનીબોરુ તા. ધોળકા સંન. /લોક. ન. ૧૬૭/૧ ની ૭૭૮૦ ચો. મી. જમીનનાં કલ્જેદારશ્રી રાજુભાઈ હરખચંદ પાલાની તા. ૨/૪/૧૧ની પૂર્તિ આરજી
- (૨) સાહીશ્રી તા.પ. ધોળકાનો તા. ૪/૪/૨૦૧૧ નો અભિપ્રાય.
- (૩) મામલતદારશ્રી ધોળકા નો પત્ર નં. ૪મન/૧.૧૪/૧૧ તા. ૮/૪/૧૧ નો અભિપ્રાય
- (૪) ન.ટી.એન.સી/બી.અલ્યુ/એસ.આર.તાલુકા/ન. ૧૪/૧૧ મામલતદાર અને કૃષિપંચની કચેરી ધોળકા તા. ૧૧/૪/૧૧
- (૫) વધુરાનાં ખાસ જમીન સંપાદન અધિકારી કલે.કચેરી અ.વાદ.એસ.આર.ન. ૭૨૫/૧૧ તા. ૮/૪/૧૧
- (૬) બીજી વધુરાનાં ખાસ જમીન સંપાદન અધિકારી. કલે.કચેરી અ.વાદ. એસ.આર.ન. ૭૨૫/૪/૧૧ (૭)
- (૭) સરકારશ્રીનાં મહેસુલ વિભાગનાં ઠરાવાન. કમાંક/ બખ્ર/૧૦૦૫/૪૨૫/ક/તા. ૧/૭/૦૮
- (૮) જમીન મહેસુલ સહીતા સને ૧૮૭૮ ની કલમ દિપ અન્યથે
- (૯) તા.પ. ધોળકાની ખાસ સભાની તા. ૬/૭/૦૮ ની બેઠકનો ઠરાવ નં. ૭૪

:: હુકમ ::

મોજે નાનીબોરુ તા. ધોળકાનાં સંન. ૧૬૭/૧ ની ૭૭૮૦ ચો. મી. જમીનનાં રહેણાંકનાં હેતુ માટે રજુ કરેલ ખાન મુજબ બાંધકામ કરી ખેતી સિવાયનો ઉપયોગ કરવાની પરવાનગી આપવા અંગેની કલ્જેદારની આરજી અને તા. ૨/૪/૧૧ તથા તા. ૨/૪/૧૧ નાં રોજ મળેલ છે. સવાલ વાળી જમીનને બિનું ખેતી પરવાનગી આપવા અંગે સંબંધિત કચેરીઓના અભિપ્રાયો મેળવેલ છે. જે સંદર્ભે ૨ થી હું જણાવ્યા મુજબ તમામ અભિપ્રાયો હકારાત્ક આવેલ છે. જે પરતે વચાણ કમાંક ૮ થી બિનું ખેતી પરવાનગી આપવા લેવાયેલ નિર્ણય અનુસાર કલ્જેદારે રજુ કરેલ ખાન મુજબ બાંધકામ કરી ખેતી સિવાયનો ઉપયોગ કરવાની પરવાનગી કલ્જેદારને જમીન મહેસુલ સહીતા સને ૧૮૭૮ ની કલમ દિપ મુજબ નીચેની શરતોએ આપવામાં આવે છે.

અંશ	સંન./લોક.ન.	૭/૧૨ મુજબનું. ક્રેનફલ ચો.મી.	માંગણી/નકશામુજબનું ક્રેનફલ	વાણિજ્યનો વિશેષધારાનો દર (૧૦ પેસા)
૧	૧૬૭/૧	૦-૭૭-૮૦	૭૭૮૦	૭૭૮.૦૦

નોંધનો:-

- આ પરવાનગી ડેટની જમીનનો વિશેષધારો વાંચિક દર ચો. મી. એ ૦. ૧૦/- પેસા પ્રમાણે ૩૭૭૮/- અંકે રૂપિયા સાત સો આશાંસેસી પુરા ઠરાવવામાં આવે છે. વિશેષધારાની આ રકમમાં અત્રેથી ફેરફારો કરવામાં નાં આવે ત્યાં સુધી કબજેદારે આ વાંચિક વિશેષધારાની રકમ મહેસુલી વર્ષ ૨૦૧૦-૨૦૧૧ થી દર વર્ષ ૧૮૮ ઓગાણના રોજ ભરવાની રહેશે. વિશેષધારાની રકમ ઉપરાત કબજેદારે તે ઉપરાત નક્કી થતો લોકલ ફ્રેડ, શિકાડા ઉપકર તથા અન્ય કરવેરા પણ દર વર્ષે ચુકવવાના રહેશે.
- આ પરવાનગીથી બિનખેતીમાં ફેરવાની થતી જમીન રૂપાંતર કર દર ચો. મી. એ ૩.૨/-પ્રમાણે ૩.૧૫૫૮૦/- અંકે રૂપિયા પંદર હજાર પાંચ સો ગેસી પુરા ઠરાવવામાં આવેલ જે તા. ૨૦/૪/૧૧ ના રોજ વસુલ આવેલ છે.
- બિનખેતી ઉપયોગ શરૂ કરવામાં ન આવે ત્યા સુધી શરત નં-૧માં ઠરાવેલ વિશેષધારો દર વર્ષ બમણા દરે ભરણીનો રહેશે. (માત્ર અમદાવાદ શહેર સંકુલ વિસ્તાર પુરતુ). સુપ્રિમ કોર્ટમાં આ વાબતનો નિકાલ આવેથી તે ચુકાદાને આવિન ભરવાનો રહેશે.
- આ પરવાનગી ફક્ત રહેણાંકના હેતુ માટે જ આપવામાં આવેલ છે. જેથી અનેની પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય પરવાની ડેટની જમીનનો કે તે ઉપરના બાંધકામનો અન્ય હેતુ માટે ઉપયોગ થઈ શકશે નહીં.

૫. નગર નિયોજકશી પાસે વિકાસ પરવાનગી મેળવી લેવાની રહેશે. અને ત્યારબાદ આપેલ વિકાસ પરવાનગીમાં દર્શાવેલ બાંધકામોમાં સુધારા વધારા કે તેમાં દર્શાવ્યા સિવાયના વધારાના બાંધકામો અતેથી પુરુષ મંજુરી મેળવ્યા સિવાય થઈ રહેશે નહીં. ખાનમાં દર્શાવેલ માર્ગના માપો વાળી જમીન ખુલ્લી જુઘા તરીકે રાખવાની રહેશે. અથે ઉવલોપમેન્ટ ઓફોરીના વિસ્તારમાં બાંધકામમાં ફેરફાર કરતા અગાઉ જુજરાત પંચાયત અધિનિયમ અન્વયે સ્થાનિક ગ્રામ/નગર પંચાયતની રજાયઠી બાંધકામો શરૂ કરતાં અગાઉ જુજરાત પંચાયત અધિનિયમ અન્વયે સ્થાનિક ગ્રામ/નગર પંચાયતની રજાયઠી મેળવી લેવાની રહેશે.
૬. બાંધકામ શરૂ કરવામાં આવે કે તરતજ કઈ તારીખથી બાંધકામ શરૂ કર્યું તેની લેખીત જાણ ૧(માસ)ની અંદર સર્કલ ઈન્સ્પેક્ટર મારફતે અને કરવાની રહેશે.
૭. નમુના અમા સંશોધો આપવાની રહેશે.
૮. બાંધકામ પાછું પડશે તેમાં સહેલાઈતી સંપત્તી છે તેવા પદ્ધતો વાપરી શકે નહીં.
૯૦. આપરવાનગીની તારીખથી છે માસમાં બાંધકામ શરૂ કરી તેણું વર્ષમાં ત૊મે બાંધકામો પુરા કરવાના રહેશે.
૧૧. એનુભવાનગી આપતા પહેલા માપણી ફી રૂ.૬૦૦/- અને ઇપિયા છુંસો પુરા ઇસ્ટીકટ ઈન્સ્પેક્ટરશી, લેન્ડ રૂક્ઝની ધ્વારા ચલાણા નં. ૬૮૧ તાં ૩૦/૩/૧૧ થી ભરેલી છે. તે મુજબ આ પરવાનગી હુકમની જમીનની માપણી કરાવવી પડશે અને માપણી મુજબના સાઈડ ધ્વાનો ની ચાર નક્લો અને રજુ કરવી પડશે. જમીનની માપણી ધ્વારા બાદ તેમાં વધારો કે ધ્વાણી ધ્વારો તો તે ઉપરનો વિરોધધ્વારો તથા અન્ય ઉપકરો કબજેદારે ભરવાનો રહેશે.
૧૨. સદર યોજનામાં પાછી મુલુકનાની તથા ગંડા પાછીના નિકાલ માટે પોંય ગર્દ વિવસ્થા અરજદારે પોતાના ધર્યે અને જોખમે કરવાની રહેશે. ઉનેજ લે-આઉટ તેમજ સેટ્ટીક ટેન્ક તથા સોડર્વેલ ની સાઈઝ અને સંખ્યા નેશનલ લિલ્લીંગ કોડ મુજબ રાખવાનું રહેશે.
૧૩. વગર મંજુરીએ કે કાયદા કાપુન વિરુદ્ધ કોઈપણ કાપનું બાંધકામ કરવામાં આવશે. તો સક્ષમઅધિકારી તાલુકા વગર અનુભૂતિ કરેલ ખાન મુજબ જ બાંધકામ કરવાનું રહેશે. જો તેમ કરવામાં કસુર થશે પંચાયત અનુભૂતાવાદ ઠરાવે તે મુદતમાં આવા બાંધકામો કબજેદારે હુર કરવાના રહેશે. જો તેમ કરવામાં કસુર થશે તો: કબજેદારના ખર્ચે બાંધકામ હુર કરવામાં આવશે અને ખર્ચની રકમ જમીન મહેસુલની બાકી તરીકે કબજેદાર પાસેથી વસુલ કરવામાં આવશે. અથવા આપેલ પરવાનગી રેફ કરવામાં આવશે.
૧૪. આ પરવાનગી જમીનની તબદીલી કરશર અને જમીન અંગેના બીજા કાપદાઓનેઅધિન રહેશે.
૧૫. આવેલ અન્ય શરતોનું પાલન કરવાનું રહેશે. શરતનંગ કરવામાં આવશે તો પરવાનગી રેફ કરવામાં આવશે.
૧૬. આ હુકમમાં અગર સનદમાં કોઈ કારકુની અથવા ગણતરીની ભુલ હશે તો તેમાં સુધારો થઈ શકશે.
૧૭. જમીન ઉપર કરવાના સુચિત બાંધકામનો ખાન કેન્દ્ર સરકારના ઉદ્યન મંત્રાલયના તાં - ૧૫/૩/૭૯ ના જોગવાઈઓ મંજુર કરેલ ખાન મુજબ જ બાંધકામ કરવાનું રહેશે. તથા સદર પત્રથી નક્કી કરવામાં આવેલ અનુભૂતોનું પાલન કરવાનું રહેશે. જોગવાઈઓ સંબંધિત રહીને તેથાર કરી સંબંધિત જોગવાઈઓ પાસે તે મંજુર કરાવ્યા બાદ મંજુર કરેલા બાંધકામના ખાન મુજબ બાંધકામ કરવાનું રહેશે. અને સક્ષમ અધિકારી પાસે તે મંજુર કરાવ્યા બાદ મંજુર કરેલા બાંધકામના ખાન મુજબ બાંધકામ કરવાનું રહેશે. અને આ રીતે કરવામાં આવેલ બાંધકામમાં ભવિષ્યમાં કોઈ કશશરી કે સુધારા કરવા અંગે બાંધકામનો ખાન મંજુર કરાવવાના અંગે તથા તેના અનુસંધાનમાં બાંધકામ કરવાનું થાય તારે કેન્દ્ર સરકારના ઉક્ત જાહેરનામાની જોગવાઈઓ અને નિયમોનું પાલન થાય તે પ્રમાણે બાંધકામ કે સુધારા કરવાના રહેશે.
૧૮. આ જમીન નો ઓરોડામ કે રેલ્વે રસ્તાની નંબર આવતી છોપ તો જે તે ખાતાના અધિકારીશીના નો ઓફ્ઝેક્શન માં શરતો સુચવવામાં આવેલ છોપ તો તે તમામ શરતોનું યુસ્તિપૂર્ણ પાલન કરવાનું રહેશે.
૧૯. સરવાળાણી જમીનમાંથી હલેકટ્રીક લાઇન, ટેલીફોન લાઇન કે તારની લાઇન પસાર થતી હશે તો આવી લાઇન કે સરવાળાણી જમીનમાંથી હલેકટ્રીક લાઇન, ટેલીફોન લાઇન કે તારીખે સોધાય તે તારીખથી આ જમીન ઉપરના ક્રીમન થતી અને આવેલ મકાન ક્રીમન કે તારીખે કબજેદારને જે તારીખે સોધાય તે તારીખથી આ જમીન ઉપરના ક્રીમન થતી અને આવેલ મકાન ક્રીમન થતી અને આવેલ મકાન ક્રીમન થતી અને આવેલ મકાન ક્રીમન થતી.
૨૦. જિનખેતીની મંજુરી મેળવ્યા બાદ ભવિષ્યમાં જો શહેરી જમીન ટોચ મધ્યદાનો કાપદો ૧૮૭૯ આ જમીનને લાગુ પડે તો તે કાયદા હેઠળના સક્ષમ અધિકારીશીનો હુકમ આપદી ગણાશે. આથી જે બાંધકામ અરજદાર તરફથી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ બાંધકામ હુર કરવાનું અથવા કરશર કરવાનું જે તે સક્ષમ અધિકારીશી તરફથી કરવામાં આવે તો તે તમામ અરજદારના ખર્ચે અને જોખમે કરવામાં આવશે અને કોઈ વળતર મેળવવા હક્ક દાવો થઈ શકે નહીં.
૨૧. સોપ્રથમ તેથાર થેલ મકાનનો કબજે તેના કબજેદારને સોપવામાં આવે તે પહેલા ક્રીમન પ્લોટનો પોંય રીતે વિકાસ કરવાનો રહેશે. તેમજ ક્રીમન પ્લોટના કોઈપણ જતનો માલસામાન રાખી શકાશે નંદી. તેમજ સોપ્રથમ તેથાર થેલ મકાન ફેટનો કબજે તેના કબજેદારને જે તારીખે સોધાય તે તારીખથી આ જમીન ઉપરના ક્રીમન થતી અને પ્લોટ તમામ કબજેદારની સહિતારી મિલકત બનશે. તેના ઉપર મુજબ માલિકનો કોઈ હક્ક રહેશે નંદી અને તે

- સહીયારી મીલકત (કોમન ખોડ) ના ઘોહરની ભાગની એકબાજુ ખુલ્લી રાખી બાડીની ત્રણ બાજુ એ ફેન્સીંગ કરાવી લેવાની રહેશે.
૨૨. ગૃહ હાઉસિંગ પ્રોજેક્ટના ડિસ્ટ્રિક્ટમાં તેના યોજકશીએ તેમજ સહકારી મંડળીના ડિસ્ટ્રિક્ટમાં તેના ચેરમેનશીએ તૈયાર થયેલા મહિનનો તેના કબજેદારન સોપાય તે પહેલા પાણી, સ્ટીટ લાઈટ, આંતરીક રસ્તા, ઇનેઇજ અને સેનેટરીની પુરસી સગવડતા ઉન્ની કરવાની રહેશે.
૨૩. આં પરવાનગી અરજદારે રજુ કરવામાં આવેલ વિગતોના આધારે આપવામાં આવેલ છે. રજુ કરેલ એકપણ કે તેથી વધુ વિગતો ખોટી હોવાનું જાહેર થયે આ પરવાનગી આપોચાપ રદ થયેલ ગણારો. તેથી જમીન મહેસુલ કાપદાની ડલમ-જલ એ ડેઢણ પગલા લેવાને પાત્ર રહેશે અને વધુમાં કબજેદારે તત્કાલીન અમલમાં બીજો જોઈ પણ કાપદાની જોગવાઈઓનો બાધ આવ્યા સિવાય ઈન્દીયન ચીનલ કોડ ડેઢણ કોણદાત્રી થુન્ના પાટેપગલો લેવાને પાત્ર બનશે.
૨૪. સરકારશીના વખતોવખતના નિયમો અને નિયંત્રણોનું પણ યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે.
૨૫. સોસાપટીના રહીશો માટે આંતરીક રસ્તા પેનર અથવા ડામરથી તૈયાર કરવાના રહેશે.
૨૬. કોમન ખોડ તથા રસ્તાની માન્ય ખુલ્લી જમીનનું ઉપર અનંધોપ્રકૃત બાંધકામ કે દબાણ કરીશકાશે. નહીં, કોમન ખોડનું હરાણ કે અન્ય રીતે વેચાણ થઈ શકશે નહીં. કે તથાંથી થઈ શકશે નહીં. તેમજ આ જમીનોની આજુબાજુના વિસ્તારોમાં રહેતા લેખનોના સુખેકારીના હકકોને નુકશાન કરે તેવો ઉપયોગ કરી શકાશે નહીં.
૨૭. માંગણીવાળી જમીન ઉપર બાંધકામ કરતા પહેલા સરકાર માન્ય સંસ્થા પાસે સોછિલ ટેસ્ટ ફરજિયાત કરાવવાનું રહેશે. આ ટેસ્ટ રીપોર્ટની નકલ બાંધકામના રેકૉર્ડમાં તથા પ્રમાણિત નકલો. અને તથા સરકારી/અર્ધસરકારી સંબંધિત કચેરીમાં ફરજિયાત રજુ કરવાની રહેશે. તેમજ બાંધકામ ખરીદનાર દરેક વ્યક્તિને તેની નકલ પુરી પાડવાની રહેશે.
૨૮. બાંધકામ માટે લોડબેરીંગાને બાંધકામની નિયોજનાની અધિકારી ધ્વારા બાંધકામ માટેના જે કોઈ ધારાધોરણ કે નીતિનિયમો બાંધકામ માટે નકલી કરે તે ધારા ધોરણ માટેની મંજુરી એજન્સી પાસેથી મેળવ્યા પછી જ બાંધકામ હાથ ધરી શકાશે. જે કોઈ બાંધકામ કરવામાં આવે તે બાંધકામ કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ વિગતો સંબંધિત કચેરીઓને પુરી પાડવાની રહેશ.
૨૯. ભારત સરકારશીના નેશનલ બિલ્ડિંગ કોડ અનુસાર સક્ષમ અધિકારી ધ્વારા બાંધકામ માટેના જે કોઈ ધારાધોરણ કે નીતિનિયમો બાંધકામ માટે નકલી કરે તે ધારા ધોરણ માટેની મંજુરી એજન્સી પાસેથી મેળવ્યા પછી જ બાંધકામ હાથ ધરી શકાશે. જે કોઈ બાંધકામ કરવામાં આવે તે બાંધકામ કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ વિગતો સંબંધિત કચેરીઓને પુરી પાડવાની રહેશ.
૩૦. ભુંકપ્રુષ માટેની ડિઝાઇન માટે સરકાર માન્ય એજન્સીની સલાહ ફરજિયાતપણે લેવાની રહેશે, અને સલોહ જમીન પારક માટે ફરજિયાતપણે બધાનકર્તા રહેશે. મંજુર થયેલ ભુંકપ્રુષ ડિઝાઇનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
૩૧. સવાલવાળી જમીનના અને તે ઉપર કરવામાં આવનાર બાંધકામની સ્થિરતા અને સમર્થતાની સંપૂર્ણ જવાબદારી બાંધકામ કરનાર ઈજનેર, સ્ટંકચરલ ઈજનેર તથા જમીનમાલીક/કબજેદારની રહેશે. આ બાંધકામ ભુંકપ સામે ટકી શકવાની ક્ષમતાવાળું કરવાનું રહેશે. બિલ્ડિંગ મટીરીયલ અને જાહેર સલામતી બાંબતે ખાસ કરીને ભુંકપ, વાવાજોડા અને આગ પ્રતિરોધકતા-બાબતે બાંબતે નેશનલ બિલ્ડિંગ કોડ અને ઈન્દીયન સ્ટાન્ડર્ડ સેપેસીફિકેશનની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
૩૨. નાયબ નગર નિયોજકશીએ મંજુર કરેલ ખાન મુજબ વરસાઈ પાણીના નિકાલ માટે પરખેલેટીવ વેલ બનાવવાના રહેશે અને તેની એક નકલ અને એક માસમાં આપવાની રહેશે.
૩૩. નાયબ નગર નિયોજકશીએ મંજુર કરેલ ખાન મુજબ ખારફુલા, આઈ.એસ.કોડ મુજબ બનાવવાના રહેશે અને ટિલ્લા પંચાયતના સિચાઈ વિભાગના ના.કા.ઈશ્રી, પાસેથી કમ્પલીશન.સર્ટી મેળવ્યા બાદ ઉપયોગ કરવાનો રહેશે..
૩૪. મંજુર થયેલ ખાન અને મંજુર થયેલ હુકમ અને શરતોની નકલ સભાસદોને આપવાની રહેશે.
૩૫. શાયર સેફટીની જરૂરી વ્યવસ્થા મફાનનો ઉપયોગ શરૂ કરતા અગાઉ કરાવી લેવાનો રહેશે. અને તે મુજબની કામગીરી પુર્ણ કરવાની રહેશે.
૩૬. વરસાઈ પાણીના સંશોધ અને ઉપયોગની વ્યવસ્થા કરવાની રહેશે. આ અંગેના નકશા એક માસમાં અને મંજુર કરાવી લેવાનો રહેશે.

३७. आ मंजुरी गणोत्थाराने प्राप्त रहेशे.
३८. वरशादी पाइना निकालमां नउतर रूप न थाय ते रीते जांफकाम करवानु रहेशे. तथा पाइना निकालनी व्यवस्था करवानी रहेशे.
३९. सरकारशी ना महेसुल विभागना ठाव कमाक बजप्प/१००६/४२५/क ता. १/७/०८ ना परिशिष्ट-४मा दर्शविल शरतोनु पालन करवानु रहेशे.
४०. खोटनी उके आंतरीक रस्ता उपर अने क्रीमन खोटमा क्रीडने अंतराय रूप न थाय ते रीते योऽय स्थग्नेश दृ १०० चो.मी.अ० १(अ०) वृक्षनु वृक्षारोपण करवानु रहेशे. वृक्षारोपण भोडमः भोड ओक्टो-१०१० सुधी करी अने जाण करवानी रहेशे. त्यारभाद वृक्षोनी स्थिती अंगे अङ्ग वर्ष सुधी दरेक वर्षमा जुलाई मासमां रीपोर्ट करवानो रहेशे.
४१. नांदर नियोजकशी प्यान भंजुर करवानी शरते. (त्रिशमांसमां)

उपरनी क्रीडपण शरतनो लंग थरे तो परवानी रह करवामां आवशे. जमीन महेसुल कायदानी क्लब-७८ चो.शालय इष्टजेदारनी हाक्कलपटी करवामां आवशे. उपरनी क्रीडपण शरतनो लंग थरे तो जमीन महेसुल नियमोना नियम-१०० अनुसार योऽय ते दृ करवामां आवशे. क्रीडपण योऽय लागे तेवा अंक के वधु पगला लई शकाशे.

बिजाषः—सरकारशीना ता. १/७/०८ना ठारावथी आवेल परिशिष्ट-४

*Cert*  
तालुका विकास अधिकारी  
धोणका



रवाना:-

प्रति,

श्री राजुभाई उरभचंद गाला

सरानांगु : नवमीत डाउस, शुड्कुल रोड, भेमनगर,  
अमदाबाद, ગુજરાત.

नक्ल रवाना:-

- (१) तलाही कम भंजीशी नानीबोइ, ता.धोणका तરफ जाण सारु तथा स.न नं. ५८०/१ नी ७७८० चो.मी जमीनना गाम दक्षतरे जરुरी नो॒ करवा सारु. विशेषधारानी रकम वसुल करी तेनी जाण अने करवानी रहेशे.
- (२) डिस्ट्रीક्ट इन्सપेक्टरशी, लेन्ड एक्ट, अંગબાર નગર તરफ जરुरी કार्यવाही थવा सारु. तथा दक्षतरे जરुरी नो॒ करवा सारु.
- (३) नગर नियोजकशी पहेलो મाण, નंદનવન શોपीંગ कોમ્પ્લેક્સ, માધવબાગની પાછળ જિર્યાનગર, અમદાવાદ તરफ જાણ સારુ.
- (४) મામલતદારશી, (ઈ-૪રા)તા.धોળકા
- (૫) નાયાલ કલેક્ટરશી, (ઈ-૪રા) પાંત ધોળકા ગુજરાત. અમદાવાદ

નકલ સવિનય રવાના:-

१. કલેક્ટરશી, અમદાવાદ જિલ્લો, અમદાવાદ તરફ.  
સરકारशीना મહेसुल વિભાગના ઠરાવ તा. १/७/०८ ના આધારે જાણ સારુ
२. મે.જિલ્લા વિકાસ અધિકારીશી, જિલ્લા પંચાયત અમદાવાદ તરફ  
૨/- સરકारશीના મહेसुલ વિભાગના ઠરાવ ન-१/७/०८ ના આધારે જાણ સારુ

ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ, ગાંધીનગર ના ઠરાવ કમાક: ખખ૪/૧૦૦૬/૪૨૪/ક તા.૧-  
૭-૨૦૦૮માં કરેલ જોગવાઈ

### પરિશિષ્ટ-૪

બિનખેતી પરવાનગી મેળવવા ઈચ્છિતા અરજદારે પાલન કરવાની શરતો:  
(બિનખેતી પરવાનગી આપનાર સક્ષમ સત્તાએ આ પરિશિષ્ટ બિનખેતીની પરવાનગી આપતા હુકમ

સાથે અચુક જોડવાનું રહેશે.)

- ૧) ડિઝ્ટીકટ ઇન્સ્પેક્ટર ઓફિસર્સ રેકર્ડ્સ બારા ઈસ્યુ કરાયેલ માપણી શીટ કે જેના ઉપર મુજબ ટીપ્પણીની છે પણ દર્શાવેલ હોવી જોઈશે. રજુ કરાયેલ ખાન તથા બેન્ચ-આઉટ ખાન સક્ષમ ક્ષાંકાએ મંજુર કરાવેલ હોવો જોઈશે.
- ૨) બાંધકામ શરૂ કરતા પહેલા બાંધકામના નકશા સક્ષમ અધિકારી પાસે મંજુર કરવાના રહેશે. પરંતુ અરજદારબિનખેતી પરવાનગી મેળવ્યા વગર આવા બાંધકામની રજા ચિહ્ન મેળવી શકશે નહીં.
- ૩) શહેરી વિસ્તાર ક્રયા ટાઉન ખાનીંગ સ્કીમ મંજુર થઈ ગઈ છે ત્યાં જી.ડી.સી.આર.ઓન્નીંગના નિયમો અનુસાર બાંધકામ કરવાનું રહેશે.
- ૪) મંજુરાયેલ નજીશા મુજબ આરોગ્ય અને સ્વાસ્થ્યની દંસ્ટિએ ગંડા પાણીના નિકાલની જોગવાઈ કરવાની રહેશે.
- ૫) અરજદારે રીબન ડેવલપમેન્ટ રૂલ્સ જીવે જે તે રસ્તાનો પ્રકાર ધ્યાન લઈ રસ્તાના મધ્યબિંદુથી બાંધકામ વચ્ચે અંતર જોળવવાનું રહેશે.
- ૬) ઓધોગિક ડેટુ માટે મંજુરી માંગેલ હોય તો બાંધકામ કરતા પહેલા જિલ્લા ઉધોગ અધિકારીની જરૂરી મંજુરી મેળવ્યાબાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- ૭) ફ્લોર મીલ/સિનેમા/ફુરીંગ/સ્ટીલેન્ન્સ/થીયેટર/માટે બિનખેતી પરવાનગીના કામે જિલ્લા મેલ્લસ્ટેટની જરૂરી મંજુરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- ૮) પેટોલ, ડિઝલ કેરોસીન, સી.એન.જી., એલ.પી.જી., પંપ નાપવા માટે બિનખેતી પરવાનગીના કામે બાંધકામ શરૂ કરતા પહેલા જિલ્લા મેલ્લસ્ટેટની જરૂરી મંજુરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- ૯) ઇન્દ્રીયન-એક્સપ્લોઝીવ એક્ટ અન્વયે મેળેનીઝ, ફાયરવર્ક્સ, દારૂખાના માટે બિનખેતીની કાર્યવાહી કરતા પહેલા જિલ્લા મેલ્લસ્ટેટની જરૂરી મંજુરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- ૧૦) સવાલવાળી જમીન જો જેલથી નજીક હોય તો ૧૮૪ મીટરનું અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે.
- ૧૧) સવાલવાળી જમીન જો રેલ્વે છદની નજીક હોય તો રેલ્વેની છદથી ૩૦ મીટર જગ્યા છોડી બાંધકામ કરવાનું રહેશે.
- ૧૨) સવાલવાળી જમીનઊપરથી અથવા બાજુમાંથી વિજળી શ્રીઝના તાર/ હાઇટેન્શન પાવર અગર થાંબલા આવેલ હોય ત્યારે તે અન્વયે લાગુ પડતાં નિયમોનું પાલન કરવા અને તે મુજબ બાંધકામ કરવાનું રહેશે.
- ૧૩) બિનખેતી માંગવામાં આવી હોય તેવી જમીન જો એરોડ્રમ આસપાસના ૨૦ કી.મી ની નીજૃયામા આવતી હોય ત્યારે બાંધકામની ઉંચાઈ તથા એરોડ્રમની દંસ્ટિએ જરૂરી એવું ના વાંધા પ્રમાણપત્ર સીવીલ એવીએશન ખાતા પાસેથી મેળવવાનું રહેશે. અને સીવીલ એવીએશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- ૧૪) ભારતીય વાયુસેના ઉવાઈમથક તથા ઇન્સ્ટોલેશનથી ૫૦૦ મીટરની ત્રીજ્યા બહાર બાંધકામ કરવાનું રહેશે.
- ૧૫) ઓ.એન.જી.સી.ના કુલ નજીકમાં આવેલ જમીનના ડિસ્સામાં અરજદારે સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે:
- ૧૬) નર્માદા કેનાલ/અન્ય સિંચાઈ કેનાલની નજીકમાં આવેલ જમીનની બાબતમાં અરજદારે સુચિત બાંધકામ માટે જોળવવાના થતાં અંતર અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- ૧૭) અરજદારે/થંયાં જરૂરી હોય ત્યાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કાયદા નીચે રક્ષિત સ્મારક (Protected Monuments) તરીકે જહેર કરેલ પ્રાચીન સ્મારકથી ૧૦૦ મીટર સુધીનું અંતર જોળવવાના પ્રવત્તમાન જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

- ૧૮) અરજદારે/ જ્યાં હોય ત્યાં વારતીય વન અધિનિયમ ડેફા અનામત વન જમીન કે રક્ષિત વન તરીકે જાહેર કરેલ વન/ જમીનથી જાળવવાના થતા અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- ૧૯) અરજદારે/ જ્યાં જરૂરી હોય ત્યાં વનચુલું સરકાર અધિનીયમ ૧૯૭૨ અન્વયે અભ્યારણ અથવા રાષ્ટ્રીય ઉપવન તરીકે જાહેરાત કરેલ કોઇપણ વિસ્તોરની હદ્થી જાળવવાના થતા અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

અરજદારે ઉપરોક્ત સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમાં નિષ્ફળ જરૂરી તો શરૂઆતભંગ ગણી સરકાર એવિકારી કાર્યવાહી કરશે.

Arif

તાલુકા વિકાસ એવિકારી  
ઘોણકા.

